

## Part - 1

વિભાગ : (૧)

ભવાઈ : ઉત્પત્તિ અને વિકાસ

Bhavai : Origin and Development

પ્રકરણ (૧) : ભવાઈ શબ્દની ઉત્પત્તિ

પ્રકરણ (૨) : ભવાઈનું ઉપરૂપકો સાથે અનુસેંધાન

પ્રકરણ (૩) : ભવાઈના સ્વરૂપની વિકાસરેખા -  
મધ્યયુગથી સાંમૃતકાળ સુધી

## Part - 1 , chapter - 1

પ્રકરણ (૧)

### ભવાઈ શબ્દની વ્યુત્પત્તિ

ભવાઈ શબ્દ માટે અનેક વિધ્વાનોએ પોતાના મત પ્રદર્શિત કર્યા છે.

કેટલાક વિધ્વાનોએ ભવાઈ શબ્દને દેવી - દેવતાઓ સાથે રાંકણ્ય છે.

અમદાવાદના સ્વ. હરમહેણશંકર મુખ્યીએ ભવાઈ બેટલે "ભવાની (અંબા) + ચાઈ (માતા)"<sup>૧</sup> ભવાની માતા સમકા રજૂ થાય તે ભવાઈ, એવો અર્થ તારંયો છે.<sup>૨</sup> પેટલાદ તાલુકાના સુશાંત ગામના શ્રી ત્રિપુરશંકર પ્રિનેટીએ ભવાઈ બેટલે "ભવ (જીવન) ની ચાઈ (માતા)"<sup>૩</sup> એમ કહ્યું છે. શ્રી નગીનલાલ દવે તથા શ્રી નમહીપત્રરામ નિલકંઠે 'ભવ' નો અર્થ 'શિવ' કરી ભવાઈને શિવ સાથે જોડી છે. ભવ (શિવ) અને ચાઈ (માતા) એ એ શબ્દો મળી ભવાઈ શબ્દ બન્યો હોવાનું અનુમાન કર્યું છે.<sup>૪</sup>

શ્રી જયશંકર (સુંદરી) બોજકે ભવાઈ બેટલે 'ભવવહી - જીવનનો ચોપડો (જીવતરનો ચોપડો)' એમ અર્થ કર્યો છે.<sup>૫</sup> શ્રી સુંદરી ભવાઈ કર્ણાના જ્ઞાતા હતા. નટ હતા. ભવાઈની રજૂઆત ધ્વારા અપાતા લોકશિક્ષાણને ધ્યાનમાં લઈ તેમણે આ અર્થ તારંયો હોય તેમ લાગે છે.

'The Modern Gujarati - English Dictionary' ના

સૈપાદકો શ્રી ભાનુશંકર મહેતા અને શ્રી ભરતરામ મહેતાએ તેમના શબ્દકોશમાં  
ભવાઈ શબ્દનો અર્થ 'ભાવ' એટલે 'નટ' તેને 'આઈ' પ્રત્યતિ લાગી ભવાઈ  
શબ્દ બંધો હોવાનું જણાવી, ભવાઈ એટલે 'નટ' એમ અર્થ તારંયો છે.<sup>૫</sup>

શ્રી રસિકલાલ પરીજે રસોઈયો, ગર્વથો જેવો શબ્દ ભવૈથો છે, એમ  
કહી ગવાઈ ઉપરથી ગાયન અને ભવાઈ ઉપરથી ભાવન શબ્દ તારંયો છે.<sup>૬</sup>

ડૉ. સુધાબહેન દેસાઈએ તેમના 'ભવાઈ' નામના શોધનિર્બંધમાં ભવાઈનો  
અર્થ 'ભાવન' કરી ભવાઈ વેશોમાંથી ભાવન શબ્દ દર્શાવ્યું કેટલિક કરીએ  
ટકી છે.

(૧) "ભાવન દાતીવાડાનો, ધોડીનો ભાવન  
ધ્વાડાનો ભાવન." (રીસોટોભાનો વેશ)<sup>૭</sup>

(૨) "માંદુણ નાયકે ભાવન જોડ્યાં, જોડ્યા, જોડ્યા બોલ ચાર  
તેજલ ઝંડાની કિરતીરે ગઈ સમંદર પાર"  
(ઝંડા ઝુલણનો વેશ)<sup>૮</sup>

આમ કેટલાક વિદ્વાનોએ ધર્મજીથોનો આધાર હઈ 'ભવાઈ' કે 'શિવ'  
સાથે ભવાઈને જોડી તેને ધાર્મિક સંજ્ઞા આપી છે. જ્યારે કેટલાક વિદ્વાનોએ  
નાટ્યશાસ્ત્ર કે કલાના સંદર્ભમાં ભાવ, ભાવન, નટ વગેરે અર્થ તારંયાં છે.

શ્રી જ્યોતિર સુંદરી ભવાઈને ભવ-વહી, જીવતરનો ચોપડો એટલે કે  
 "સારા નરસા કમોની ખતવણી - પાપ પુણ્યનું મૂલ્યાંકન" એ સંદર્ભમાં  
 ઉપયોગ કર્યો છે. તેની સામે એક બિજો તર્ક મૂકી શકાય. ભવૈયા એ ઉત્તર  
 ગુજરાત અને સૌરાષ્ટ્રના કણૂભી પટેલોના આશ્રિત રહ્યાં છે. પેઢીઓથી તેમના  
 સંબંધો યજમાન - નાયકના રહ્યા છે. નાયકો (ભવૈયા) પોતાના યજમાનોની  
 યાદી વિગતવાર રાખે છે અને વર્તમાન પેઢીને તેમના પૂર્વજીના ગુણ-દોષા તથા  
 તેમના તરફથી મળેલ દમની માહિતી ગીતોમાં હાણી રસપ્રદ રીતે વણિ છે.  
 જેનું કારણ હ્યાત પેઢી સાથેના સંબંધો ગાઢ જનાવવા તથા વધુ દાન  
 મેળવવાનો હેતુ હોઈ શકે. પરંતુ નાયક અને યજમાનોના ભવોભવના સંબંધોના  
 સેંદર્ભે પણ ભવાઈ શબ્દ અયોજ્ય શકાય.

શારદાતનય ના મત પ્રમાણે રૂપકો રસપ્રદાન હતાં જ્યારે ઉપરુપકો  
 ભાવપ્રદાન હતાં<sup>૬</sup>. ભારતીય પારંપારિક લોકનાટ્યોમાં ઉપરુપકોની અસર  
 દેખાય છે. ખાસ કરીને અભિનય તથા ભજવણીની શૈલીમાં નૃત્ય અને ગીતની  
 પ્રધાનતાના કારણે ભવાઈમાં ભાવોનું નિરુપણ વિશેષપણે જોવા મળે છે. તે  
 રીતે વિચારતાં 'ભાવન' શબ્દ ભવાઈની વધુ નજીક છે. જૈન દેરાસરોમાં  
 ભાવન ગવાતાં હતાં. હેમચૈલ્યાર્થના સમયમાં જૈન ધર્મ સ્વીકાર કરેલ, એવા  
 શ્રીમાણી પ્રાહ્મણો મંદિરોમાં ભાવન ગાતા હતાં. આ પ્રાહ્મણો જે પાછળથી

૪

ભોજક તરીકે ઓળખાયો<sup>૧૦</sup> અને અસાઈત સાથે સામાજિક અને બયવસાયી સંબંધે જોડાઈ ભવાઈમાં આવ્યું. તેમની સાથે 'ભાવન' શબ્દ આવ્યો હોવાનું અનુમાન કરી શકાય. ડૉ. સુધાબહેન દેસાઈએ તેમના શોધનિર્બંધ ભવાઈમાં 'ભાવન' ને ભવાઈનું સાહિત્યક સ્વરૂપ કહ્યું છે.

'ભવાઈ' ને તેમાં ભાવપ્રધાન લોકનૃત્યો - ગીતોને કારણે 'ભાવન' શબ્દ સાથે જોડવી ચોગ્ય લાગે છે. ભવાઈની સાહિત્યક રચનાઓને 'ભાવન' કહેવાની હો, બેમ અનુમાન કરી શકાય. આ 'ભાવન'નું નિર્માણ તે 'વેશ' જેને 'ભવાઈવેશ' નામ અપાયું છે.

'ગાયન' નામની સાહિત્યકૃતિને જીવંત કરનાર ગવૈયો અને જીવંત કૃતિ તે 'ગવાઈ' (ગાયકી). તેમ 'ભાવન' નામે ઓળખાતી સાહિત્યકૃતિને જીવંત કરનાર ભવૈયો અને જીવંત કૃતિ તે 'ભવાઈ' એ અર્થધટન નાટ્યકલાની પરિભાષામાં ચોગ્ય લાગે છે.

ભવાઈને 'ભવાઈવેશ' કહેવાય છે. 'વેશ'નો સામાન્ય અર્થ 'વેશભૂષણ' અગર 'પ્રોટાક' થાય છે. ભવાઈમાં 'વેશ' શબ્દ વેશ પહેરી રજૂ થતાં 'પાત્ર' અને 'પાત્રાધ્વારા' રજૂ થતી 'કૃતિ' બેમ બે અર્થમાં ઉપયોગમાં લેવાય છે. પાત્રોના નામ સાથે 'વેશ' શબ્દ જોડી કૃતિનું નામ ઓળખાવાય છે. ઉદાહરણ - 'ઝંડાનો વેશ', 'શ્રાહમણનો વેશ', 'જશમા ઓહણનો વેશ' વગેરે

સંદર્ભ

૧. 'Bhavai' - ડૉ. સુધાબહેન દેસાઈ (૧૯૭૨) પૃ. ૨
૨. ઐજન પૃ. ૨
૩. ઐજન પૃ. ૨
૪. ઐજન પૃ. ૨
૫. ઐજન પૃ. ૨
૬. ગુજરાતનું લોકનાટ્ય ભવાઈ - શ્રી રત્નિલાલ રાણી, નાચક  
ગુજરાત દીપોત્સવી ચંક (વિ. સંવત ૨૦૪૧) માં પ્રસિદ્ધ થયેલ  
લેખ પૃ. ૮૦
૭. 'Bhavai' - ડૉ. સુધાબહેન દેસાઈ (૧૯૭૨) પૃ. ૩
૮. ઐજન પૃ. ૨૭૩
૯. શારદાતનથ : ભાવપ્રકારાન હિ-દી અનુવાદ : મદનમોહન  
અશ્વાલ (૧૯૭૮) અષ્ટમ અધિકાર શલોક ૩ પૃ. ૩૨૧  
ઈસ્તાત્મકા દર્શાવે વિંશાશ્વાત્મકા જતાઃ ।  
સેધાં સ્રૂપકર્સંજાડપિ પ્રાયો દૃશ્યાત્મયા કર્વાચિત् ॥  
વિંશાશ્વાત્મકભેદાદ્યા પ્રકાશયન્તોઽત્ત્રા લેઝણો : ।

શારદાતનથે કુલ ૩૦ મ્રકારના નાટક હોવાનું જણાવી, નાટક,  
મ્રકરણ ઈંત્યાદિ દશ નાટ્યરૂપોને રસાત્મક તથા અન્ય વીસ નાટ્યરૂપોને  
ભાવાત્મક કહ્યાં છે. દૃશ્યતત્વને લીધે તેમને રૂપક રૂપક આપ્યામાં  
જણાવી હોવાનું જણાવ્યું છે. વસ્તુતા: તેમણે જેમને રસાત્મક કહ્યાં છે તે  
રૂપકો છે અને ભાવાત્મક જણાવ્યાં છે તે ઉપરૂપકો છે.

૧૦. ભવૈય। - શ્રી જોરાવરસિંહ જાદવ અર્જુનાનદ જુન ૧૯૮૭ માં પ્રસિદ્ધ  
થયેલ લેખ પૂર્ણ